

Cyclone Tauktae to make landfall on May 18 between Porbandar and Mahuva

Ahmedabad : Cyclone Tauktae, which is currently lying over eastcentral Arabian Sea is likely to reach the Gujarat coast on the evening of May 17 and make landfall between Porbandar and Mahuva on May 18, according to the India Meteorological Department (IMD). The weather department has already issued a cyclone alert for Gujarat and Diu coasts.

Tauktae, which has already intensified into a very severe cyclonic storm over eastcentral Arabian Sea, is moving northwards with a speed of 11 km per hour during the past six hours. On Sunday morning at around 8.30 am, the system was lying about 120 km west-southwest of Panjim, 420 km south of Mumbai, 660 km south-southeast of Veraval and 810

km southeast of Karachi. "It is very likely to intensify further during the next 24 hours. It is very likely to move north-northwestwards and reach Gujarat coast in the evening hours of May 17 and cross Gujarat coast between Porbandar and Mahuva (Bhavnagar district) around May 18 early morning," the IMD said in its weather bulletin. The system is likely to have a maximum sustained wind speed of 150-160 km per hour gusting to 175 km per hour. According to weather experts, Tauktae is likely to weaken after the landfall. It will lose its intensity and become a cyclonic storm on May 18 and will eventually become a depression on May 19. The system has already caused multiple deaths in Kerala and Karnataka.

Daily surge in COVID-19 cases declines to 8,210, vaccination drive halted for 2 days due to cyclone



Ahmedabad : Gujarat has reported 8,210 fresh cases of COVID-19 in the past 24 hours ending 5 pm on Sunday. The addition of the fresh cases has taken Gujarat's total tally past 7.52 lakh. The Gujarat government has suspended the immunisation drive against COVID-19 for the next two days due to tropical cyclone Tauktae. Chief Minister Vijay Rupani said that the health department staff has been kept on standby due to the cyclone and therefore, the immunisation drive has been suspended. Unfortunately, 82 deaths were reported in the state in the past 24 hours. The fresh fatalities have taken Gujarat's COVID-19 related death toll to 9,121. While 13

deaths were reported from Ahmedabad, Surat reported 12 deaths. Seven deaths have been reported from Vadodra, two deaths have been reported from Kutch and two deaths from Patan. Gandhinagar reported two deaths, Jamnagar reported seven deaths and Rajkot reported nine deaths. Amreli reported two deaths. Of the 8,210 fresh cases reported on Sunday, 2,773 cases have been reported from Ahmedabad, 705 cases have been reported from Surat, 882 cases have been reported from Vadodra,

and 194 cases have been reported from the state capital Gandhinagar. This apart, Rajkot has reported 535 cases, Bhavnagar has reported 269 cases, Mehsana 174 cases, and Jamnagar 319 cases. Meanwhile, Junagarh has reported 411 fresh cases of the virus, whereas the tribal district of Panchmahals has reported 195 fresh cases. Dahod has reported 123 cases, Amreli 167 cases and Kheda 165 cases. Similarly, Bharuch has reported 102 cases, Valsad has reported 107 cases, Anand 223 cases, and Patan reported 98 cases.

UTL INDUSTRIES LIMITED
 L27100GJ1989PLC012843
 Registered Office: 607, World Trade Centre, Sayajinagar, Vadodra-390005, Gujarat
 Phone : 0265-236397
 Email Id : utlindustries@gmail.com, website: www.utlindustries.com

Notice
 NOTICE is hereby given, that pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, meeting of the Board of Directors of the Company is scheduled to be held on Monday, 24th May, 2021, to consider and approve, inter-alia, the Audited Financial Results of the Company for the quarter and year ended 31st March, 2021 and other business as may be brought up for consideration. The outcome of the above meeting will be available on the website of the Company viz. www.utlindustries.com and on the website of BSE Limited viz. www.bseindia.com.

For UTL Industries Limited Sd/-
 Sonal Golani
 Company Secretary And Compliance Officer

Place: Vadodra
 Date: 17.05.2021

GOKUL AGRO RESOURCES LIMITED

CIN: L15142GJ2014PLC080010
 Regd. Office: Office No. 801-805, Dwarakesh Business Hub, Survey No. 126/1, Opp. Visamo Society, B/h Atishay Bellevue, Motera, Ahmedabad- 380005.

Statement of Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the Fourth Quarter/Year ended March 31, 2021. (Rs. in Lakhs except EPS)

Particulars	Standalone Financial Results			Consolidate Financial Results		
	Three months ended on 31.03.2021	Corresponding three months in the previous year ended on 31.03.2020	Year to date figures for current period ended 31.03.2021	Three months ended on 31.03.2021	Corresponding three months in the previous year ended on 31.03.2020	Year to date figures for current period ended 31.03.2021
	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
Total Income from Operations	254,522.76	121,365.64	766,807.06	268,844.01	147,139.75	838,658.94
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	2,305.59	367.53	5,454.53	2,844.43	477.64	6,604.61
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2,305.59	367.53	5,454.53	2,844.43	477.64	6,604.61
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	1,398.32	214.24	3,464.29	1,898.07	325.50	4,468.82
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	1,399.89	196.87	3,465.86	1,910.72	429.67	4,479.28
Equity Share Capital	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90
Reserves excluding Revaluation Reserves as per Balance Sheet of previous accounting year	-	-	23,211.73	-	-	27,399.01
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)						
a) Basic (Rs.)	1.06	0.16	2.63	1.44	0.25	3.39
b) Diluted (Rs.)	1.06	0.16	2.63	1.44	0.25	3.39

Notes:
 The above is an extract of the detailed form of Unaudited Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Quarterly Financial Results is available on the Stock Exchange websites and on the website of the Company. <https://beta.bseindia.com/stock-share-price/gokul-agro-resources-ltd/gokulagro/539725> and https://www.nseindia.com/live_market/dynaContent/live_watch/get_quote/GetQuote.jsp?ymbl=GOKULAGRO&illiquid=0&smFlag=0&ktFlag=0

Notes Related to Standalone Financial Results :-
 1 The above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 17th May, 2021.
 2 The above financial results for the quarter/year ended on March 31, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognised accounting practices and policies to the extent applicable.
 3 The Company is mainly engaged in Agro based Commodities and as such there are no separate Reportable Segment as per Indian Accounting Standard " Operating Segment " (Ind AS-108). Thus, no separate disclosure for Segment Reporting is made.
 4 The Code on Social Security, 2020 (Code) relating to employee benefits during employment and post-employment benefits has received Presidential assent on 28th September 2020. The Code has been published in the Gazette of India. However, the effective date of the Code is yet to be notified and final rules for quantifying the financial impact are also yet to be issued. In view of this, the Company will assess the impact of the Code when relevant provisions are notified and will record related impact, if any, in the period the Code becomes effective.
 5 In March 2020, the World Health Organization has declared Covid-19, a global pandemic. Consequent to this, Government of India declared a nation-wide lockdown and later on the same was lifted with some restrictions. The company remains watchful of the potential impact of Covid-19 pandemic, particularly the "second wave" on continuous basis. The company's management has continued to make the assessment of likely adverse impact on business and financial risks. As per current assessment, there are no significant impact on carrying amount of property, plant and equipments, inventories, goodwill, intangible assets, trade receivables, investments and other financial assets is expected, and the management is continue to monitor changes in future economic conditions.
 Being a part of the essential commodity industry, the company was allowed to continue its operations/manufacturing activities of its units with minimum labour and staff as suggested by Government from time to time, hence the group companies were able to manage the same at optimum level.
 From the measure taken above, the management believes that there is not much adverse impact on the business and financial risk and believes that the impact is likely to be short term in nature. The management does not see any medium to long term risk on the company's ability to continue as a going concern and meeting its liabilities as and when they become due subject to the situation doesn't worsen from the current position of the pandemic.
 Given the uncertainties associated with nature, condition and duration of covid-19 pandemic, the impact on the company's financial statements will be continuously made and provided for as and when required. However, a definitive assessment of the impact in the subsequent period is highly dependent upon the circumstance they evolve.
 6 The Company's rating has been assigned at [ICRA] BBB- for long term facilities and [ICRA] A3 for short term facilities by ICRA Limited.
 7 The figures for the quarter ended March 31, 2021 and March 31, 2020 represent the difference between audited figures for the financial year and the limited reviewed figures for the nine months period ended December 31, 2020 and December 31, 2019 respectively.
 8 Previous year figures have been regrouped or rearranged wherever necessary to meet with the current year's reporting requirements.

Notes Related to Consolidated Financial Results :-
 1 The above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 17th May, 2021.
 2 The above financial results for the quarter/year ended on March 31, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognised accounting practices and policies to the extent applicable.
 3 The Company is mainly engaged in Agro based Commodities and as such there are no separate Reportable Segment as per Indian Accounting Standard " Operating Segment " (Ind AS-108). Thus, no separate disclosure for Segment Reporting is made.
 4 The Code on Social Security, 2020 (Code) relating to employee benefits during employment and post-employment benefits has received Presidential assent on 28th September 2020. The Code has been published in the Gazette of India. However, the effective date of the Code is yet to be notified and final rules for quantifying the financial impact are also yet to be issued. In view of this, the Company will assess the impact of the Code when relevant provisions are notified and will record related impact, if any, in the period the Code becomes effective.
 5 In March 2020, the World Health Organization has declared Covid-19, a global pandemic. Consequent to this, Government of India declared a nation-wide lockdown and later on the same was lifted with some restrictions. The respective group company's management remains watchful of the potential impact of Covid-19 pandemic, particularly the "second wave" on continuous basis. The respective group company's management has continued to make the assessment of likely adverse impact on business and financial risks. As per current assessment, there are no significant impact on carrying amount of property, plant and equipments, inventories, goodwill, intangible assets, trade receivables, investments and other financial assets is expected, and the management is continue to monitor changes in future economic conditions.
 Being a part of the essential commodity industry, the group companies were allowed to continue its operations/manufacturing activities of its units with minimum labour and staff as suggested by Government from time to time, hence the group companies were able to manage the same at optimum level.
 From the measure taken above, the respective group company's management believes that there is not much adverse impact on the business and financial risk on the group companies and believes that the impact is likely to be short term in nature. The respective group company's management does not see any medium to long term risk on the group company's ability to continue as a going concern and meeting its liabilities as and when they become due subject to the situation doesn't worsen from the current position of the pandemic.
 Given the uncertainties associated with nature, condition and duration of covid-19 pandemic, the impact on the group company's financial statements will be continuously made and provided for as and when required. However, a definitive assessment of the impact in the subsequent period is highly dependent upon the circumstance they evolve.
 6 The figures for the quarter ended March 31, 2021 and March 31, 2020 represent the difference between audited figures for the financial year and the limited reviewed figures for the nine months period ended December 31, 2020 and December 31, 2019 respectively.
 7 Previous year figures have been regrouped or rearranged wherever necessary to meet with the current year's reporting requirements.

Date: 17.05.2021
 Place: Ahmedabad

Sd/-
 Jayesh K. Thakkar
 Managing Director

Gujarat Congress in-charge Rajeev Satav succumbs to post-COVID complications

Ahmedabad : Rajya Sabha MP and Gujarat Congress in-charge Rajeev Satav died at a hospital in Pune on Sunday due to post-COVID complications. He was 46. Notably, Satav, who is considered a close aide of Congress leader Rahul Gandhi, had tested positive for the virus in the state after being treated in confinement on April 22 and undergoing treatment for the past 23 days. He was on ventilator support after his health deteriorated. Apart from Congress leaders, Prime Minister Narendra Modi too expressed grief on the passing away of Satav. PM Modi said, "Anguished by the passing away of my friend from Parliament, Shri Rajeev Satav J. He was an upcoming leader with much potential. Condolences to his family, friends and supporters. Om Shanti."

devoted to the people of India. I have no words, just prayers for his young wife & children. May they have the strength to carry on without him." Congress CWC member KC Venugopal said, "Congress has lost its frontline warrior, CWC Member, M.P. most promising young leader and my friend, Sh. Rajiv Satav today. I am devastated by the irreparable loss. Party will forever miss his indelible dedication, connect & immense popularity. My heartfelt condolences!" Rajeev Satav was also the AICC Secretary in charge for Saurashtra region during the Gujarat Assembly poll 2017, where Congress won the maximum seats. After that, he was made the Gujarat in-charge of the party replacing party veteran Ashok Gehlot.

Amit Shah reviews Gujarat, Maharashtra's preparedness for cyclone Tauktae

Ahmedabad : With cyclone Tauktae likely to reach the Gujarat coast by Monday evening and make landfall by Tuesday early morning, Union home minister Amit Shah on Sunday reviewed the preparedness of Gujarat and Maharashtra for the 'very severe cyclonic storm'. Shah chaired a virtual review meeting which was attended by chief ministers of Gujarat and Maharashtra as well as the administrator of Daman and Diu and Dadra and Nagar Haveli. The development comes amid the second wave of the COVID-19 pandemic which has wreaked havoc in Maharashtra and Gujarat. Shah has ordered the state governments to make adequate power supply arrangements in all hospitals, laboratories, vaccine cold chains and medical facilities dealing with COVID-19. With the movement of the vehicles also likely to be affected due to the cyclone, the Union minister directed adequate stocks of essential

medicines and supplies in healthcare facilities. The states have been also instructed to ensure the safety of temporary hospitals set up near oxygen generating plants and shift the patients to safer alternatives if required. He has also asked the state governments to maintain a buffer stock of oxygen for two days. Amit Shah said the areas in Gujarat that are likely to be affected because of the cyclone consist of industrial clusters. He said that the industries should remain alert and ensure safety. He also asked the state governments to ensure the safety of power plants so that the supply to hospitals and other critical institutions is not affected. Amit Shah assured the states of all central support required by them to counter the impact and devastation of the cyclone. He said that a 24x7 control room is functioning in MHA, which can be contacted at any time for any assistance by the states. Notably, the Centre has kept the Indian Coast Guard, Navy, Army and Air Force units on standby for immediate deployment of required, whereas surveillance aircraft and helicopters are carrying out aerial sorties.

Toyota Kirloskar Motor Employees Volunteer to Support COVID-19 Patients

Ahmedabad, Continuing its relief measures in the fight against COVID-19, Toyota Kirloskar Motor (TKM) today announced that some of its employees would begin to contribute and support the National Doctor Helpline>About 60 TKM employees have volunteered to support COVID-19 patients to connect with the registered doctors. Their role will also include preparing doctor shifts besides helping ensure all those patients who call the helpline number can reach the doctors through proper scheduling and follow-ups. The 1st batch of volunteers are receiving the necessary online training from appointed agencies following which they will soon be deployed. The volunteers are part of TKM's 'COVID Warriors Club', which was formed to support the local communities and Government departments in dealing with the rising demand for medical care due to the COVID-19 infections.

Talking about the new initiative, Mr. G. Shankara, Vice President, HR and Services, Toyota Kirloskar Motor, said, "We had formed the COVID Warriors Club to support the local community and our Government agencies, in the overhoming surge in the second COVID wave. (20-4)

SBFC FINANCE PRIVATE LIMITED
 (ERSTWHILE SMALL BUSINESS FINANCER INDIA PVT. LTD.)
 Ahmedabad, Gurukul, 201, 2nd floor ship complex
 opp oxford tower, gurukul road memnagar Ahmedabad - 380052
 Telephone: +91 22 67875334 | Fax: +91 22 67875334 | www.sbfc.com
 Corporate Identity Number: U67190MH2009PT178270

PUBLIC NOTICE
 This is to inform the Public that Auction of pledged Gold Ornaments will be conducted by SBFC Finance Pvt. Ltd. on 23.05.2021 at 10:30 am at Gurukul Branch, address: SBFC Finance Pvt. Ltd, 201, 2nd floor, Ship Complex, Opp. Oxford Tower, Gurukul Road, Memnagar, Ahmedabad-380052 Gujarat.

The Gold Ornaments to be auctioned belong to Loan Accounts of our various Customers who have failed to pay their dues. Our notices of action have been issued to these borrowers.
 The Gold Ornaments to be auctioned belong to Overdue Loan Accounts of our various Customers mentioned below with branch name.

MANINAGAR BRANCH			
Loan No.	Application No.	Loan No.	Application No.
FR00763560	198100026	FR00829922	198100716
FR00796541	198100383	FR00830513	198100721
FR00796530	198100382	FR00831003	198100727
FR00796622	198100381	FR00831837	198100732
FR00816752	198100591	FR00831861	198100734
FR00816763	198100592	FR00831911	198100736

GURUKUL BRANCH			
Loan No.	Application No.	Loan No.	Application No.
FR00773118	906100114	FR00813773	906100370
FR00797968	906100271	FR00818068	906100374
FR00805496	906100301	FR00818044	906100373
FR00805493	906100300	FR00819290	906100377
FR00805490	906100299	FR00820872	906100383

For more details, please contact SBFC FINANCE PRIVATE LIMITED
 Contact Number(s): 1800-102-8012
 (SBFC FINANCE PRIVATE LIMITED reserve the right to alter the number of accounts to be auctioned & / postpone / cancel the auction without any prior notice.)

